



## ફેર પ્રેક્ટીસ કોડ

આ વાજબી વ્યવહાર સંહિતા ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલ "એનબીએફસી માટે વાજબી પ્રેક્ટિસ કોડ પરની મુગરદ્શિરકા" ના અનુપાલનમાં તૈયાર કરવામાં આવી છે અને તેનો ઉદ્દેશ તેના ઋણ લેનારાઓને કંપની દ્વારા અનુસરવામાં આવતી પદ્ધતિઓની અસરકારક વિહંગાવલોકન પ્રદાન કરવાનો છે અને દેવાદારોને જાણ કરવામાં સફળ બનાવવાનો છે. કંપની દ્વારા ઓફર કરવામાં આવતી નાણાકીય સુવિધાઓ અને સેવાઓના સંદર્ભમાં નિર્ણયો. આ સંહિતા લોનના નિયમો અને શરતો પર પ્યારપૂત જાહેરાતો અને ઉધાર લેનારાઓ સાથે વ્યવહાર કરતી વખતે અનુસરવામાં આવતી પ્રક્રિયાઓ પરના સામાન્ય સિદ્ધાંતોને આવરી લે છે. આ કોડ હિન્દુજા લેલેન્ડ ફાઇનાન્સ લિમિટેડ ("કંપની") દ્વારા ઓફર કરવામાં આવતી તમામ શ્રેણીના ઉત્પાદનો અને સેવાઓને લાગુ પડે છે.

**આ કોડના મુખ્ય પ્રાથમિક હેતુઓ નીચે મુજબ છે.**

- બોરોવર સાથે વહેવાર કરવામાં સ્ટાન્ડર્ડ નક્કી કરીને યોગ્ય અને પારદર્શી વ્યવહાર કરવો
- કંપની અને બોરોવર વચ્ચે સારા સંબંધો વિકસાવવા.
- ગ્રાહક ઈન્ટરફેસ સાથે જરૂરી નિયમનો સાથે સુસંગત થવું
- ગ્રાહક હેરાન ગતો ને નીવારવા માટે યોગ્ય મેકેનીઝમ કરવું

**(i) લોન માટે અરજી અને તેની પ્રક્રિયા.**

- a) એ. બોરોવર દ્વારા સમજો શકે તેવી ભાષા અગર સ્થાનિક ભાષામાં બોરોવર સાથે વ્યવહાર સાથે વ્યવહાર કરવાનું રહેશે.
- b) બી. દરેક પ્રોડક્ટ માટે જરૂરી માહિતી ઉપર આધાર બાકી કંપની દરેક પ્રોડક્ટ માટે ઓફર કરવાની રહેશે.
- c) સી. લોન અરજી સાથે તમામ જરૂરી માહિતી કે જે બોરોવરના હોત ને અસર કરતી હોય કે જેથી અર્થ પુર્ણ સરખામણો અન્ય એનબીએફસી દ્વારા આપેલ અને નિયમો સાથે ઓફર કરી શકાય. લોન અરજો ફોર્મ તમામ દસ્તાવેજો બતાવશે કે જે અરજો ફોર્મ સાથે રજુ કરવાના રહેશે.
- d) ડી. કંપની તમામ લોન અરજાન પાવતી સ્વીકારશે. જે લોન અરજી સાથે સમય ઘડઠેલ હોય તેની પાવતી જણાવેલ હોય તેનો નિકલા કરવાનો રહેશે.
- e) ઈ. કંપની વ્યાજજબો સમય અવધીમાં લોન અરજો ચકાસશે અને જો વધારાની માહિતી - દસ્તાવેજોનો ઝરૂર હોય તો તે બોરોવરને તાત્કાલીક તે અંગેની જાણ કરશે.



(ii) લોન એપ્રેઈલ અને શરતો -

ર કંપનો આશ્વાસન આપે છે કે બોરોવર દ્વારા ફેડીટ અરજો સાથે માન્ય આકારણી કરેલ છે. કંપનીની લોન પોલીસી અને એસ.ઓ.પી. સાથે લાઈનમાં આકારણી કરવાની રહેશે.

a. કંપની સેંકશન લેટર દ્વારા બોરોવરને સમજી શકાય તેવી ભાષા અગર સ્થાનીક ભાષામાં અગર લેખિત ભાષામાં જાણ કરશે અને અરજીનો પ્રક્રિયા અને વાર્ષિક વ્યાજદર સહિત શરતો અનુસાર લોન મંજૂર કરશે.

કંપની જો લોન રોજકટ થાય તો લોન લેનાર સાથે વાર્તાલાપ કરશે.

b. જો ઉધાર લેનાર દ્વારા લોન કરારની સામગ્રીની શરતો અને નિયમોનું પાલન ન કરવા બદલ ઇંડ વસૂલવામાં આવે તો તેને ઇંડના ચાજર તરીકે ગણવામાં આવશે અને તે એડવાન્સ પરના ઇંડના વ્યાજના સ્વરૂપમાં રહેશે નહીં. શિક્ષાત્મક ચાજરનું કોઈ મૂડીકરણ હોવું જોઈએ નહીં એટલે કે આવા ચાજર પર કોઈ વધુ વ્યાજની ગણતરી કરવામાં આવશે નહીં.

c. આ લોન ખાતામાં વ્યાજના ચક્રવૃદ્ધિ માટેની સામાન્ય પ્રક્રિયાઓને અસર કરશે નહીં.

d. શિક્ષાત્મક શુલ્ક વાજબી અને અનુપાલન સાથે અનુરૂપ હોવા જોઈએ અને કંપની પાસે બોડર દ્વારા મંજૂર કરાયેલા ઇંડાત્મક શુલ્ક હશે.

e. કંપની લોન કરારના ભૌતિક નિયમો અને શરતોનું પાલન ન કરવા બદલ વ્યાજબી ઇંડ વસૂલશે અને લોન કરાર/મુખ્ય હકીકત નિવેદનમાં પ્રમાણ અને કારણ જાહેર કરશે અને મુખ્ય વ્યાજ દર અને સેવા ચાજર હેઠળ વેબસાઈટ પર પ્રદર્શિત કરશે.

f. આવા ઇંડના શુલ્ક પર વધુ વ્યાજની ગણતરી કરવામાં આવશે નહીં.

g. વ્યક્તિગત ઋણ લેનારાઓને વ્યવસાય સિવાયના અન્ય હેતુ માટે મંજૂર કરવામાં આવેલી લોનના કિસ્સામાં ઇંડના શુલ્ક, ભૌતિક નિયમો અને શરતોના સમાન અનુપાલન માટે બિન-વ્યક્તિગત ઋણધારકોને લાગુ પડતા ઇંડના ચાજર કરતાં વધુ નહીં હોય.

h. કંપનીએ તેના રેકોર્ડમાં ઉધાર લેનાર દ્વારા આ નિયમો અને શરતોની સ્વીકૃતિ રાખવી જોઈએ.

i. કંપની લોનના વિતરણ સમયે તમામ ઋણ લેનારાઓને લોન કરારમાં દર્શાવેલ દરેક બિડાણની નકલ સાથે લોન કરારની નકલ આપશે.



(iii) લોન મંજૂર કરતા સમયે શરતોમાં ફેરબદલ સહિતની વિગત કંપનો આવો મંજૂરીના અનુસરણ સમયે નિયમો અને શરતો મુજબ સમયસર લોન આપશે.

- કંપની શરતો સહિત ચુકવણુ પરિશિષ્ટ, વ્યાજદર, સર્વિસ ચાર્જ, પુનઃ ચુકવણા ચાર્જ વિગેરેમાં ફેરબદલ અંગે બોરોવરને નોટીસ આપશે. કંપની આશ્વાસન આપશે કે વ્યાજદરમાં ફેરબદલ અને ચાર્જનો અસર આગળ થશે. લોન કરાર આ અસરનો જરૂરી જોગવાઈ ધારણ કરશે.
- લોન કરાર સાથે સુસંગત કરાર હેઠળ ચુકવણા અગર પરફોર્મન્સ માટે બોલાવવુ/ કાર્યવાહી કરવો નું અનુસરણ થશે.
- કંપની લોનનો બાકી રકમ પૂર્ણ થયેથી તમામ બાકીના પુનઃ ચુકવણા ઉપર તમામ સિક્વોરીટી રીલીઝ કરશે જે બોરોવર વિરૂધ્ધ કંપનીને વ્યાજબી/ કાયમી દાવો હકક હોય. જો આવો હકક ઉપયોગ કરેલ હોય તો બોરોવરને બાકીના દાવા અને પરિસ્થિતિ અનુસાર તમામ માહિતો નોટીસ દ્વારા આપવાની રહેશે અને જ્યાં સુધી સંબંધોત દાવો પૂર્ણ ન થાય ત્યાં સુધી સિક્વોરીટી કંપની પોતાની પાસે રાખવા હકદાર રહેશે.

(iv) સામાન્ય

- કંપની બોરોવરને લોન કરારમાં જણાવેલ શરતોના હેતુ સિવાય વ્યવહારમાં હસ્તક્ષેપ કરવાથી દૂર રાખશે. (સિવાય કે નવી માહિતી બોરોવર દ્વારા જણાવેલ ન હોય તે કંપનીના ધ્યાનમાં આવે)
- બી. જો બોરોવર પાસેથી વિનંતીનો પાવતી બોરોવલ એકાઉન્ટ તબદોલ કરવા માટે મળે તો સંમતિ અગર અન્યત્ર રીતે કંપનીને વાંધો હોય તો તે આવા વિનંતી પત્ર મળેથી ૨૧ દિવસમાં આપવાનું રહેશે. આવા તબદોલી પારદર્શીય કોન્ટ્રાક્ટ શરત મુજબ કાયદાથી સુસંગત રહેશે.
- કંપની ધિરાણની બાબતમાં લિંગ, જાતિ અને ધર્મરના આધારે ભેદભાવ કરશે નહીં. જો કે, આનાથી કંપનીને ફરેડિટ-લિંક્ડમાં ભાગ લેવાથી બાકાત નથી. સમાજના નબળા વર્ગોર માટે યોજનાઓ ઘડવામાં આવી છે.
- લોનની વસૂલાતની બાબતમાં, વર્ષોથી તેની નીતિ સાથે સુસંગત, કંપનીએ અયોગ્ય હેરાનગતિનો આશરો લેવો જોઈએ નહીં . ઋણધારકોને વિષમ કલાકોમાં સતત પરેશાન કરવા, લોનની વસૂલાત માટે સ્નાયુ શક્તિનો ઉપયોગ, વગેરે. કંપનીએ ઉઘાર લેનારાઓ સાથે નમ્ર અને યોગ્ય રીતે વ્યવહાર કરવા માટે કલેક્શન એક્ઝિક્યુટિવ્સ અને અન્ય સ્ટાફને પૂરતી તાલીમ આપવી જોઈએ.
- એનબીએફસીના બોર્ડ ઓફ ડિરેક્ટરે સંસ્થામાં સારી રીતે આ સંદર્ભે તકરારો દુર કરવા માટે યોગ્ય હેરાનગતી કાઢો નાંખવાની વ્યવસ્થા કરેલ છે. આવી વ્યવસ્થા આશ્વાસન આપે છે કે લોન આપનાર આ સંસ્થાના કામ કરતી વ્યક્તિ આવા નિર્ણયથી ઉપસ્થિત થતો તકરારો સાંભળશે અને બીજા ઉચ્ચ સ્તરીય ઉપર તેનું નિરાકરણ કરશે. ફેર પ્રેક્ટીસ કોડના સુસંગત ઉપર અહેવાલ અને ગ્રીવન્સ રીફ્રેસલ મીકેનીઝમની કાર્યવાહી જુદા જુદા મેનેજમેન્ટ સ્તરોએ ત્રીમાસીક સ્તરે બોર્ડને જમાવવાનું રહેશે.
- કંપની તેમના જુદા જુદા સ્ટેક હોલ્ડરનો માહિતી માટે તેમની વેબસાઈટ ઉપર ફેર પ્રેક્ટીસ કોડ રાખશે.



- g) કંપની ઉધાર લેનારને ભંડોળના વાસ્તવિક વિતરણની તારીખથી વ્યાજ વસૂલશે અને લોન મંજૂર કરવાની તારીખથી અથવા લોન કરારના અમલની તારીખથી નહીં, જો તે વિતરણની તારીખથી પહેલા હોય.
- h) મહિના દરમિયાન લોનના વિતરણ અથવા ચુકવણીના કિસ્સામાં, કંપની માત્ર તે સમયગાળા માટે વ્યાજ વસૂલશે જે મહિના દરમિયાન લોન બાકી હતી અને સમગ્ર મહિના માટે નહીં.
- i) કંપની ઉધાર લેનાર પાસેથી એડવાન્સ હપ્તા વસૂલશે નહીં પરંતુ વ્યાજ વસૂલવા માટે લોનની સંપૂર્ણ રકમની ગણતરી કરશે.

**(v) વાહનનો પુનઃ કબજો**

કંપનીને બોરોવર સાથે કોન્ટ્રાક્ટમાં ઈનબોલ્ટ રોપઝેશન કલોઝ છે કે જે કાયદાકીય રીતે અમલીકરણમાં છે. પારદર્શીય રીતે આશ્વાસન કરવા કોન્ટ્રાક્ટની શરતો જોગવાઈ અનુસાર તેને ધારણ કરશે.

- a) એ. કબજો લેતા પહેલા નોટીસ અવધી.
- b) બી. નોટીસ સમય મર્યાદા જતો કરી શકાય તે સંજોગો.
- c) સી. સીક્યુરીટીનો કબજો લેવા માટેની પ્રક્રિયા.
- d) ડી બોરોવરને સીક્યુરીટીની નિલામી - વેચાણ પહેલા લોનના પુનઃ
- e) ચુકવણા માટે આખરી તક આપવી.  
ઈ. બોરોવરને પુનઃ કબજો આપવા માટેની પ્રક્રિયા.
- f) એફ. સીક્યુરીટીના વેચાણ - નિલામી માટેનો પ્રક્રિયા.

લોન મંજૂર કરતા સમયે લોન કરારમાં જનાવેલ દરેક બીડાણની નકલ સહીત લોન કરારમાં બોરોવરને મળવાપાત્ર લોન કરારમાં બોરોવરને મળવાપાત્ર શરતોની નકલ આપવની રહેશે.

વધારા વ્યાજ દર ચાર્જ કરવાના નિયમનો

૧. કંપની વખતો વખત નિયત પોલીસો સાથે લાઈનમાં વ્યાજ દર અને અન્ય ચાર્જ નક્કી કરવામાં પ્રક્રિયા અને અંદરના સિદ્ધાંત યોગ્ય અનુસરવાના રહેશે.

કંપની બોર્ડ દ્વારા માન્ય અપનાવેલ વ્યાજ દર મોડલ અનુસરશે અને વેબસાઈટ ઉપર આપશે. વ્યાજ દર અને જોખમના ગ્રેડેશન અને રેશનલ જુદા વ્યાજના દર માટે જુદા કેટેગરી બોરોવરને અરજા ફોર્મમાં જણાવવાનું રહેશે અને મંજુરી પત્રમાં વાર્તાલાપ કરેલ છે.



**(vi)** ડિજિટલ ધિરાણ

જ્યારે પણ કંપની તેના પોતાના ડિજિટલ ધિરાણ પ્લેટફોર્મ દ્વારા અથવા બાહ્ય ધિરાણ પ્લેટફોર્મ દ્વારા ધિરાણનો આશરો લે છે, ત્યારે કંપનીએ ફેર પ્રેક્ટિસ કોડ માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ.

**(vii)** ગોપનીયતા

જ્યાં સુધી ગ્રાહક દ્વારા અધિકૃત ન હોય ત્યાં સુધી HLF બધી વ્યક્તિગત માહિતીને ખાનગી અને ગોપનીય ગણાશે. જ્યાં સુધી ગ્રાહક દ્વારા અધિકૃત ન હોય, અમે નીચેના અપવાદરૂપ કિસ્સાઓમાં સિવાય અન્ય કોઈપણ એન્ટિટીને વ્યવહારની વિગતો જાહેર કરીશું નહીં:

(a) જો અમારે વૈધાનિક અથવા નિયમનકારી કાયદા દ્વારા માહિતી પ્રદાન કરવાની હોય

(b) જો આ માહિતી જાહેર કરવાની જનતાની ફરજ છે

(c) જો અમારા હિત માટે અમને આ માહિતી (દા.ત., છેતરપિંડી નિવારણ) બેંકોને પ્રદાન કરવાની જરૂર હોય તો / નાણાકીય સંસ્થાઓ / અમારા જૂથ અને સહયોગી કંપનીઓ.

(d) અમે માર્કેટિંગ હેતુઓ માટે ગ્રાહકો વિશેની માહિતી અન્ય કોઈને આપવા માટે આ કારણનો ઉપયોગ કરીશું નહીં.

**(viii)** ફરિયાદ નિવારણ મિકેનિઝમ

ફરિયાદ નિવારણના સંદર્ભમાં એસ્કેલેશન મેટ્રિક્સ પણ કંપનીની તમામ કચેરીઓમાં નીચે પ્રમાણે દર્શાવવામાં આવશે:

1. સંબંધિત મેનેજરનું નામ અને સંપર્ક વિગતો - ફરિયાદ નિવારણ નીતિ મુજબ.

2. નીચે દર્શાવેલ ફરિયાદ નિવારણ અધિકારીનું નામ અને સંપર્ક વિગતો

3. ઓફિસ ઈન ચાર્જ, નોન-બેંકિંગ સુપરવિઝન વિભાગ, ભારતીય રિઝર્વ બેંક, ફોટર ગ્લેસીસ, રાજાજી સલાઈ, ચેન્નાઈ - 600001.

ફરિયાદો, જો કોઈ હોય તો, આ કોડના સંબંધમાં અથવા અન્યથા જો ઉપર જણાવ્યા મુજબ ઉન્નતિના પ્રથમ સ્તરે સંબોધવામાં ન આવે તો, કંપનીના ફરિયાદ નિવારણ અધિકારી (GRO) ને સંબોધવામાં આવશે -

શ્રી વંશી કુમાર

હિન્દુજા લેલેન્ડ ફાઇનાન્સ લિમિટેડ,

કોર્પોરેટ ઓફિસ, નંબર 27-A, વિકસિત ઔદ્યોગિક વસાહત, ગિન્ડી, ચેન્નાઈ-600032



અથવા [nodalofficer.grievance@hindujaleylfinance.com](mailto:nodalofficer.grievance@hindujaleylfinance.com) પર ઈમેલ દ્વારા

જો કંપનીના ફરિયાદ નિવારણ અધિકારી (GRO)ને સંબોધવામાં આવે તેના એક મહિનાની અંદર ફરિયાદ/વિવાદનું નિરાકરણ ન આવે તો ગ્રાહકને અપીલ કરી શકે છે.

ચાજર અધિકારી,

બિન-બેંકિંગ દેખરેખ વિભાગ,

ભારતીય રિઝર્વ બેંક, કિલ્લો ગ્લેસીસ, રાજાજી સલાઈ, ચેન્નાઈ - 600001

અથવા [dnbschennai@rbi.org.in](mailto:dnbschennai@rbi.org.in) પર ઈમેલ દ્વારા

(ix) મોનીટરીંગ

ફરિયાદ નિવારણ મિકેનિઝમ સહિત વાજબી પ્રેક્ટિસ કોડના પાલનની સમીક્ષા મેનેજમેન્ટ દ્વારા નિયમિતપણે કરવામાં આવશે અને સમયાંતરે બોડર ઓફ ડિરેક્ટરને એકીકૃત અહેવાલ સબમિટ કરવામાં આવશે.

\*\*\*\*\*